

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.૨, પ્રથમ માળ, કર્મયોગી ભવન, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: ૧૧૭/૨૦૧૬૧૭, “મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી” વર્ગ-૩ સંવર્ગની જગાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૨૭/૦૫/૨૦૧૮ના રોજ લેવાયેલ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તારીખ:- ૧૩-૦૮-૨૦૧૮ ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. સદરહુ પરિણામના સંબંધમાં નિયત કરવામાં આવેલ સમયમર્યાદામાં આવેલ રીચેકીંગની અરજીઓ પરત્વે મંડળ દ્વારા કાર્યવાહી હાથ ધરતાં કોઇપણ કિસ્સામાં પરિણામમાં ફેરફાર જણાયેલ ન હોઇ તારીખ:-૧૩-૦૮-૨૦૧૮ ના જાહેર કરેલ પરિણામ યથાવત રહે છે. હવે સંબંધિત ઉમેદવારોને તારીખ ૦૮/૧૦/૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે નીચેના સ્થળે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.

પસંદગી/પ્રતિક્ષાયાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે તેવા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે મુજબ છે.

### ઉમેદવારોની યાદી

સ્થળ:- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.-૨, પહેલો માળ, “કર્મયોગી ભવન”, સેક્ટર-૧૦/એ, નિર્માણ ભવનની પાછળ, ગાંધીનગર- ૩૮૨ ૦૧૦ ની કચેરી ખાતે.

૧. તમામ ઉમેદવારો માટેની સૂચના:

(૧) તમામ ઉમેદવારોએ ઉપરોક્ત સ્થળે નીચેના અસલ પ્રમાણપત્રો /દસ્તાવેજો અને તેનો સ્વ-પ્રમાણિત ૧ ઝેરોક્ષ સેટ તેમજ પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અચુક સાથે લાવવાના રહેશે.

(ક) સ્નાતકની માર્કશીટ તથા ડીગ્રી પ્રમાણપત્ર

(ખ) ધોરણ-૧૨ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર

(ગ) ધોરણ-૧૦ની માર્કશીટ અથવા પ્રમાણપત્ર

(ઘ) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

(૨) સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ના ઠરાવ મુજબનું કોમ્પ્યુટરના બેઝીક નોલેજ બાબતનું પ્રમાણપત્ર

(૩) એસ.સી./એસ.ટી./એસ.ઇ.બી.સી. વર્ગના ઉમેદવારો માટે જાતિ અંગેનું સક્ષમ અધિકારી ધ્વારા અપાયેલ પ્રમાણપત્ર

(૪) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું નિયત નમૂનાનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૨૭/૦૪/૨૦૧૦ ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ-૪ ના નમૂનામાં તા.૦૧/૦૪/૨૦૧૫ થી તા.૩૧/૦૩/૨૦૧૬ ના સમયગાળાની આવકને ધ્યાને લઈ, તા.૦૧/૦૪/૨૦૧૬ થી અરજી કરવાની છેલ્લી તા.૦૭/૦૨/૨૦૧૭ સુધીના સમયગાળાનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું પ્રમાણપત્ર અરજીમાં દર્શાવ્યા મુજબના પ્રમાણપત્રના નંબર અને તારીખવાળું લાવવાનું રહેશે.

(૫) વિકલાંગ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૧૨/૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક:પરચ/૧૦૨૦૦૮/૪૬૯૫૪૦/ગ-૨ થી તથા વખતો વખતના સુધારાઓથી નિયત થયેલ સુપ્રિન્ટેન્ડન્ટ/સિવિલ સર્જનનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

(૬) અરજીપત્રકમાં રમતગમતની લાયકાત ધરાવતા હોવાનું દર્શાવેલ ઉમેદવારોએ સામાન્ય વહીવટ વિભાગના તારીખ:૦૧/૦૮/૧૯૯૦ ના ઠરાવના નમુના મુજબ માન્ય રમતગમતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. નિયત નમૂનાના પ્રમાણપત્ર મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. માન્ય રમત ગમતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં હશે તો જ માન્ય ગણાશે અથવા રમતગમતનાં માર્ક્સ બાદ કરીને મેરીટ રીજનરેટ કરવામાં આવશે અને જે ક્રમે મેરીટમાં આવતા હશે તે ક્રમે મેરીટમાં ગોઠવવામાં આવશે. -ક્રમ નં.(૧) અને (૨) માં દર્શાવેલ પ્રમાણપત્રો તમામ ઉમેદવારોને લાગુ પડશે. જ્યારે ક્રમ નં.(૩) થી (૬) ના પ્રમાણપત્રો જે ઉમેદવારોના કિસ્સામાં લાગુ પડતા હોય તે ઉમેદવારોએ લાવવાના રહેશે.

૨. વધુમાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમના સ્થળે તારીખવાર/સમય મુજબ જે તે ઉમેદવારોના સીરીયલ નંબર દર્શાવેલ છે. તે મુજબ તેમણે ફરજિયાત હાજર રહેવાનું છે.
૩. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩, સંવર્ગની પ્રમાણપત્રોની ચકાસણી સ્થળે કોઇપણ ઉમેદવારની સાથે આવેલ વાલીઓ ને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ સ્થળે ઉમેદવારો દ્વારા મોબાઇલનાં ઉપયોગનો પ્રતિબંધ છે.
૪. ઉમેદવારે પોતાનું કોઇપણ એક આઇડેન્ટી પ્રૂફ જેવું કે ડ્રાઇવીંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ કે પાનકાર્ડ અચૂક સાથે લાવવાનું રહેશે તેમજ તેની ૧ ઝેરોક્ષ નકલ સ્વ-પ્રમાણિત કરી આપવાની રહેશે.
૫. મહિલા ઉમેદવાર જો પરણિત હોય અને અરજી તેમજ પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્ર/સરકારી ગેઝેટ કે એફીડેવીટ રજૂ કરવાના રહેશે.
૬. અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે નિયત તારીખ અને સમયે ઉમેદવાર હાજર નહિ રહે તો ઉમેદવારને "ગેરહાજર" ગણી યાદીમાંથી ગેરહાજર ઉમેદવારનો બેઠક નંબર "કમી" કરવામાં આવશે અને ભવિષ્યમાં આ બાબતનો કોઈ હક્ક દાવો ધ્યાને લેવામાં આવશે નહીં. તેની ખાસ નોંધ લેવી. અનિવાર્ય કારણોસર (માંદગી કે કૌટુંબીક મરણ) પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર ન રહી શકાય તેવા સંજોગોમાં કારણોના પુરાવા સાથે ઉમેદવારના નજીકના (મિત્ર સિવાય) વાલી અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં હાજર રહી શકશે તથા આવા વાલીએ ઉમેદવારનું સંમતિપત્રક સાથે લાવવાનું રહેશે.
૭. ઉમેદવારોની ફાળવણી તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણીને આધીન રહેશે. ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્રો / દસ્તાવેજોમાં અને ઉમેદવારની અરજીની વિગતોમાં જો કોઈ વિસંગતતા જણાશે તો આ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા જે કોઈ નિર્ણય કરવામાં આવે તે આખરી અને ઉમેદવારને બંધનકર્તા રહેશે.
૮. પ્રમાણપત્રોની ચકાસણી માત્રથી નિમણૂક માટેનો કોઈ હક્ક આપોઆપ ઉમેદવારને મળી જતો નથી. તેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. હાલમાં નિયત કરાયેલ ૪૩ જગ્યાઓ સામે કુલ- ૬૭ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. પ્રમાણપત્રોની ચકાસણી બાદ મંડળ દ્વારા કુલ -૪૩ ઉમેદવારોની પસંદગી યાદી અને કુલ જગાના ૨૦ ટકા લેખે ઉમેદવારોની કેટેગરીવાઇઝ પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.

-----